

કોર્ટ ઓફ કમિશનર (વિકલાંગ વ્યક્તિઓ માટેના)

ગુજરાત રાજ્ય

(Deemed Civil Court) વિકલાંગ ધારો (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ૧૯૯૫

ભોંયતળિયે બ્લોક નં. ૧૬, જુના સચિવાલય, સેક્ટર-૧૦, ગાંધીનગર- ૩૮૨૦૧૦

કેસ નં. ૫૪૧/૨૦૧૬

ક્રમાંક કમિ/અપગ/૨૦૧૬-૧૭ /

તા. /૦૮/૨૦૧૬

વાદી:-

શ્રી એન.આર.ખાન,

સિનિયર કલાર્ક,

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ,

ગાંધીનગર

C/o પ્લોટ નં. ૫૧૭/૧ સેક્ટર-૭ બી ગાંધીનગર

વિરુદ્ધ

પ્રતિવાદી:-

સભ્ય સચિવશ્રી,

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ,

સેક્ટર-૧૦ એ, ગાંધીનગર

વિષય:- વિકલાંગ ધારા હેઠળ રક્ષણ મળવા બાબત.

શ્રી એન.આર.ખાન, સિનિયર કલાર્ક,

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ,

ગાંધીનગર

અરજદાર શ્રી એન.આર.ખાને તા.૬/૬/૨૦૧૨ ના રોજની અરજીથી આ કોર્ટને તેઓ ચાલુ સેવાકાળ દરમિયાન વિકલાંગ બનેલ હોઇ ભારતીય વિકલાંગ ધારા, ૧૯૯૫ ની જોગવાઈ ક્રમાંક- ૪૭(૧) અને ૪૭ (૨) અન્વયે જરૂરી રક્ષણ આપવા રજૂઆત કરેલ. તેઓની આ રજૂઆતને આ કોર્ટના કેસ નં. ૫૪૧/૨૦૧૬ થી નોંધ કરી દાખલ કરવામાં આવેલ. અરજદાર શ્રી એન.આર.ખાન મોટોન ન્યુરોડીસીઝ (M.N.D.) નામની બિમારીથી પીડાતા ૮૦ ટકા વિકલાંગતા ધરાવે છે. આ અંગે તેમણેઅરજી સાથે સિવિલ હોસ્પિટલ, અમદાવાદનું સર્ટીફિકેટ રજૂ કરેલ છે.

૨. અરજદાર તા.૨૦/૨/૮૫ થી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગાંધીનગર ખાતે જોડાયેલ અને તા.૧૬/૯/૨૦૧૧ થી ધીરે ધીરે વિકલાંગતાની અસર નીચે આવેલ છે. તેઓએ તા.૧/૪/૨૦૧૬ થી દાકતરી પ્રમાણપત્ર સાથે માંદગીની રજા મૂકેલ છે. તેઓએ તબીબી સહાયના કોઈ બીલ મૂકેલ નથી કે માંગેલ નથી. તેઓને બોર્ડ ધ્વારા હિસાબી શાખાની હળવી કામગીરીમાં મૂકેલ છે.
૩. અરજદારની રજૂઆત અન્વયે અરજદાર અને પ્રતિવાદીઓને નોટીસ કાઢી આ કોર્ટ ધ્વારા તા.૧૪/૬/૨૦૧૬ના રોજ મુદત રાખવામાં આવેલ. મુદતે વાદી હાજર રહેલ છે, પરંતુ બોર્ડ તરફથી કોઈ અધિકારી હાજર રહેલ નથી. પુનઃ તા.૨૮/૬/૨૦૧૬ અને તા.૨૬/૭/૨૦૧૬ ની મુદતો દરમિયાન અરજદાર પક્ષે તેમના પુત્રશ્રી જાવેદખાન હાજર રહેલ છે, પરંતુ પ્રતિવાદી બોર્ડ તરફથી કોઈ હાજર રહેલ નથી. બોર્ડ ધ્વારા તા. ૨૮/૭/૨૦૧૬ના પત્ર સાથે લેખિત જવાબ અધિકારીશ્રીઓ ધ્વારા રૂબરૂ રજૂ કરવામાં આવેલ છે.
૪. સમગ્ર રીતે જોતાં,
- અરજદાર મોર્ટોન ન્યુરો ડિસીઝની ગંભીર બીમારીથી પીડાય છે.
 - સીવીલ હોસ્પિટલ, અમદાવાદના સર્ટીફિકેટ મુજબ તેઓ ૮૦ ટકા વિકલાંગતા ધરાવે છે.
 - અરજદારે તા.૧/૦૪/૨૦૧૬ થી માંદગીની રજા મૂકેલ છે.
 - અરજદારને બોર્ડ ધ્વારા સહાનુભૂતિ દાખવી હિસાબી શાખાની હળવી કામગીરી સોંપવામાં આવેલ છે, પરંતુ અરજદારની ફરજ પરની હાજરી અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ નથી.
૫. આથી બન્ને પક્ષકારોની લેખિત રજૂઆત, રજૂ થયેલ આધાર પુરાવા વગેરે બાબતો અને ભારતીય વિકલાંગ ધારો (સમાનતકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) - ૧૯૯૫ ની જોગવાઈઓ ક્રમાંક-૪૭(૧) અને ૪૭(૨) અન્વયેની જોગવાઈઓ, તેઓ સેવાકાળ

દરમ્યાન શારિરીક વિકલાંગ થયેલ હોય તેમને વિકલાંગ ધારો- ૧૯૯૫ ની નીચેની વિગતે લાગુ પડે છે.

(1) No establishment shall dispense with or reduce in rank an employee who acquires disability during his service.

Provided that, if an employee, after acquiring disability is not suitable for the post he was holding, could be shifted to some other post with the pay scale and service benefits;

Provided further that if it is not possible to adjust the employee against any post he may be kept on a supernumerary post until suitable post available or he attains the age of superannuation, whichever earlier.

(2) No promotion shall be denied to a person merely on the ground of his disability;

Provided that the appropriate Government may having regard to the type of work carried on in any establishment by notification, exempt any establishment from the provision of the section)

ઉપરોક્ત તમામ બાબતો ધ્યેન લઈ પ્રસ્તુત કેસમાં પુખ્ત વિચારણાને અંતે આથી નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

હુકમ

શ્રી એન.આર.ખાન, સિનીયર કલાર્ક, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગાંધીનગરને તા.૧/૪/૨૦૧૬ થી સળંગ હાજરી ગણી જે તારીખથી તેઓ માંદગીની રજા પર ગયેલ છે, તે તારીખથી તેઓને મળવાપત્ર તમામ પગાર ભથ્થાઓ ચુકવી આપવા જરૂરી કાર્યવાહી કરવા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગાંધીનગરને હુકમ

કરવામાં આવે છે. ભારતીય વિકલાંગ ધારા , ૧૯૯૫ ની જોગવાઈ ક્રમાંક -૪૭ (૧) (૨) ની જોગવાઈઓનો અમલ કરી તેઓને જે તે જગ્યા પર ચાલુ રાખવા અથવા જે તે જગ્યા પર ચાલુ રાખવાનું શક્ય ન હોય તો અધિસંખ્યકની જગ્યા પર ત્યાં સુધી ચાલુ રાખવા કે જ્યાં સુધી તેને માટે યોગ્ય જગ્યા ઉપલબ્ધ બને અથવા તે નિવૃત્તિની ઉંમરે પહોંચે તે બે માંથી જે વહેલુ હોય ત્યાં સુધી.

ઉપરોક્ત હુકમ સાથે હું પ્રસ્તુત કેસનો નિકાલ કરું છું.

(સંજય નંદન)
કમિશનર

નકલ રવાના:-

- (૧) શ્રી એન.આર.ખાન, સિનીયર કલાર્ક, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગાંધીનગર
C/o પ્લોટ નં. ૫૧૭/૧ સેક્ટર-૭ બી ગાંધીનગર
- (૨) સભ્ય સચિવશ્રી, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, સેક્ટર-૧૦ એ, ગાંધીનગર